

લોકોને તેની કાથ્થક ધમ્તનો પુથ્થ હા થીતેઉપયોગ ક્થ્થં થય તેમટે અનેક ત્થ્થ થેનો ઉપયોગ ક્થ્થેને તેને ઋદ ક્થ્થામં આવે છે. પ્થ્થ થ્થ્થેક વ્થ્થક ત્થ્થનો ઉપચ્થ્થ તેમ્થા/તેણીના ક્થ્થ ધમ્ત પથ્થ, શક્તિ ધ્થ પથ્થ, ક્થ્થયાં વધિયમં થ્થ છે અને વ્થ્થયાવસાયકિ પાથ્થ શ્થ વ્થ્થ્થકિ પથ્થ આધથ્થિતેહોય છે.

આ ઉપચ્થ્થ સ્થ્થ્થ ધ્થિતેતેકેવી થીતેખાવું-પીવું, કોથ્થ વશિધિ ટ પ્થ્થ થ્થાથ્થા બુટ અને પગના મેજાં કેવી થીતેપહેથ્થ્યાં, રેન કેવી થીતે લગાવવી, શ્થ્થ ટ અને બ્થ્થ લાઉઝના બટન કેવી થીતેલગાવવું તેશીખવવામં આવે છે, વ્થ્થ હીલચે પથ્થ ઢેસીને કેવી થીતેથ્થોથ્થ બ્થ્થાવવી અને ઘથ્થ કેવી થીતેચ્થાવવું, જેને લીધેઅપંગતનો ભથ્થ લાગતે નથી, તેમ્થ્થ હાથ્થપગ ગુમવેલા લોકો મટે ત્થ્થ થ્થ્થ આની ઈ વાથ ખાસ તેથ્થાથ્થ ક્થ્થામં આવેલ ગાડી ક્થ્થ થીતેચ્થાવલી તેશીખવવામં આવે છે, જેમ્થ્થે તેમ્થા સ્થ્થ નાચુ પથ્થ નચિત્થ્થ્થ્થ નથી તેમ્થે ક્થ્થ મ્થ્થ પચુટથ્થ કેવી થીતેવાપથ્થ્થ્થ તે શીખવાડવામં આવે છે અને ઘથ્થ્થ સાધ્થ્થનો ઉપયોગ કેવી - થીતેક્થ્થો તેશીખવવામં આવે છે.

વ્થ્થયાવસાયકિ ચ્થ્થિતિ સ્થ્થો ભવનાત્થ્થ્થ ઋ અને મનસકિ પ્થ્થ થ્થ્થ નો હોય વ્થ્થ વા લોકો સાથેકાથ્થ્થ્થ ક્થ્થે છે. ઉદા. ત્થાવ, અસ્થ્થ વસ્થ્થ્થ્થ, સન્થિફ્થેનચિા- હોય વ્થ્થ વા લોકોના કાથ્થ્થક ધ્થની નોંઘ ક્થ્થાનું, વ્થ્થ ટલે કે થેંજીદા જીવનમં તેવધે કાથ્થ્થક ધ્થમ્થથી કામ ક્થ્થે છે. શાથ્થ્થિક અને મનસકિ થીતેકાથ્થ્થક ધ્થ ન હોય તેમ્થા બળકોમં વ્થ્થયાવસાયકિ થેગ ઉપચ્થ્થ પદ્થ્થ ધ્થીનો વધે પ્થ્થ્થ્થામં ઉપયોગ ક્થ્થતે હોય છે.